https://archive.org/details/bk1425/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત,ધનસુરા

tidar.com

:: સામાજીક ઈતિહાસ::

આ સમાજની સ્થાપના એવા સમયમાં કરવામાં આવી જયારે આપણા દેશની આઝાદીની ચળવળ ખૂબ જોર શોરથી ચાલુ હતી.ત્યારે આઝાદી પહેલા ઈ.સ.વર્ષ : ૧૯૪૪ તથા વિ.સં.

Full Library on https://realpatidar.com/library

મા આ સમાજની સ્થાપના કરવામાં આવી હતી.જેના પ્રથમ પ્રમુખ તરીકે હંસરાજભાઈ માઈ ઈશનપુર અને પ્રથમ મંત્રી તરીકે કરસનભાઈ પચાણભાઈ બોરડીટીબાકંપા હાલ રકંપા એ સેવા આપી હતી.

આઝાદીના ઉદયકાળ પછી સમગ્ર દેશમાં એક નવી જ હવા ફેલાઈ લોકો ગુલામીની ઝંજીરમાંથી મુકતી પામ્યા પછી શિક્ષણનુ મહત્વ સમજવા લાગ્યા.સમગ્ર દેશમા શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું.અને તેની અસર આ સમાજને થયા વિના ના રહી શકી. માદરે વતન કચ્છમાથી આજીવિકા માટે આપણા વડીલો દેશભરમા નહી પણ વિશ્વના અન્ય દેશોમા પણ પહોંચી ગયા.તેમા ખાસ કરીને સાબરકાંઠા ,અરવલ્લી,અને કપડવંજ વિસ્તારમાં આપણા ભાઈઓ ખેતીના વ્યવસાય સાથે વધારે સંકળાયેલા છે. આ વિસ્તાર તો જાણે કચ્છમાં જ ફરતા હોઈએ એમજ લાગે.. ધનસુરા એટલે ગુજરાતનું નખત્રાણા ત્યાં સમાજ દ્વારા સંચાલીત કુમાર અને કન્યા છાત્રાલયની સ્થાપના કરવામાં આવી. જયાં હાલ ઓધવ વિધા મંદિર કાર્યરત છે.

પરમ પૂજય સંતશ્રી ઓધવરામજી મહારાજશ્રીના સાંનિદયમાં તા.૧૪/૦૪/૧૯૫૪ ના રોજ પ્રથમ સનાતની ત્રિદિવસીય અધિવેશન શ્રી કરમશીભાઈ વીરજીભાઈ ચોપડા અદયક્ષ સ્થાને હીરાપુરકંપા ખાતે કરવામા આવ્યુ હતુ. જેમાં અદયક્ષ શ્રી કરમશીભાઈ ચોપડા દ્વારા રૂ.૧૦૦૧/ નુ માતબર દાન આપવામાં આવ્યુ હતુ. તે સમયે સમાજના પ્રમુખશ્રી હીરજીભાઈ કરસનભાઈ લીંબાણી વિષ્ણુપુરા હતા.અને મંત્રીશ્રી દેવસીભાઈ રામજીભાઈ અણીયોરકંપાવાળા હતા. જે અધિવેશનમા ધનસુરા ખાતે છાત્રાલય બનાવવાનુ નકકી કરવામા આવ્યુ હતુ.જેમા છાત્રાલય માટે ફાળાની રૂ.૬૦૧૭૫/ જેટલી માતબર રકમ એકત્રિત કરવમા આવી હતી.

વર્ષઃ ૧૯૫૪ સવંત ૨૦૧૦ ને જેઠ સુદ ૧૨ ના રોજ તખતગઢ હાલ માધવકંપાના દાનવીરશ્રી વાલજીભાઈ ભાણજીભાઈ વાડીયા દ્વારા આ સમાજને રૂ.૨૫૦૦૦/ જેટલુ માતબર દાન આ ધનસુરા સમાજમા ૬ રૂમના દાતાશ્રી તરીકે આપેલ છે જેને આપણે યાદ કરતા સમાજ દ્વારા તેમની પ્રતિમૂર્તિ ની સ્થાપના સમાજ ભવનમા કરેલ છે. આપણા સમાજની ધનસુરા ખાતે તલોદ રોડ પર આવેલ જમીન રૂ.૭૦૦૨/ મા વડીલો દ્વારા રાખવામા આવેલ હતી.જેમા પચાણભાઈ લદધાભાઈ દ્વારા રૂ.૩૧૨૫/ મા રૂમ ૧ અને રૂ.૩૧૨૫/ સ્વ.રવજીભાઈ નારણભાઈ ના ધર્મપત્ની માતાજી માનબાઈના સ્મરણાર્થે બનાવી સમાજને અર્પણ કરેલ છે.સમાજની આ જમીનની ચારે બાજુ કંપાઉન્ડ વોલ અને પાકા કૂવા બનાવવા માટે આજુ બાજુના કંપાઓમાંથી ફાળો કરીને નાંણા એકત્ર કરવામા આવેલ હતા.જેનો ફુલ ખર્ચ રૂ.૧૭૧૯૮/ થયેલ હતો.તે સમયે બોરડીટીબાકંપા તરફથી રૂ.૫૦૦/ અને એદલપુરાકંપા તરફથી રૂ.૩૨૫/ જેવી રકમ દરેક કંપાઓ માથી ફાળો એકત્ર કરવામા આવેલ હતો.

આપણી સનાતન સમાજમા વર્ષઃ૧૯૭૮ મા થયેલા વિવાદમા આપણી સમાજના વિભિન્ન વિચારધારા વાળા જુથો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. તે સમયે શ્રી શામજીભાઈ સવગણભાઈ વાસાણી વડાગામ, શ્રી અરજણભાઈ વશરામભાઈ ભાવાણી એદલપુરાકંપા, શ્રી બહેચરભાઈ મૂળજીભાઈ ભાવાણી મોતેસરી, શ્રી બાબુભાઈ જશાભાઈ વેલાણી રાજપુરકંપા, શ્રી સવજીભાઈ અરજણભાઈ પોકાર વડાગામ તેમજ તેમની સાથે સમાજના અન્ય વડીલોએ સામાજીક વિવાદમા

realpatidar.com

https://archive.org/details/bk1425/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1425/page/n2/mode/1up

2022-06-25 -Dhansura Samaj History (1425)

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત,ધનસુરા

realpatidar.com

:: સામાજીક ઈતિહાસ::

આ સમાજની સ્થાપના એવા સમયમાં કરવામાં આવી જયારે આપણા દેશની આઝાદીની ચળવળ ખૂબ જોર શોરથી ચાલુ હતી.ત્યારે આઝાદી પહેલા ઈ.સ.વર્ષ : ૧૯૪૪ તથા વિ.સં. ૨૦૦૧માં આ સમાજની સ્થાપના કરવામાં આવી હતી.જેના પ્રથમ પ્રમુખ તરીકે હંસરાજભાઈ નારણભાઈ ઈશનપુર અને પ્રથમ મંત્રી તરીકે કરસનભાઈ પચાણભાઈ બોરડીટીબાકંપા હાલ બીલેશ્વરકંપા એ સેવા આપી હતી.

આઝાદીના ઉદયકાળ પછી સમગ્ર દેશમાં એક નવી જ હવા ફેલાઈ લોકો ગુલામીની ઝંજીરમાંથી મુકતી પામ્યા પછી શિક્ષણનુ મહત્વ સમજવા લાગ્યા.સમગ્ર દેશમા શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું.અને તેની અસર આ સમાજને થયા વિના ના રહી શકી. માદરે વતન કચ્છમાથી આજીવિકા માટે આપણા વડીલો દેશભરમા નહી પણ વિશ્વના અન્ય દેશોમા પણ પહોંચી ગયા.તેમા ખાસ કરીને સાબરકાંઠા ,અરવલ્લી,અને કપડવંજ વિસ્તારમાં આપણા ભાઈઓ ખેતીના વ્યવસાય સાથે વધારે સંકળાયેલા છે. આ વિસ્તાર તો જાણે કચ્છમાં જ ફરતા હોઈએ એમજ લાગે.. ધનસુરા એટલે ગુજરાતનું નખત્રાણા ત્યાં સમાજ દ્વારા સંચાલીત કુમાર અને કન્યા છાત્રાલયની સ્થાપના કરવામાં આવી. જયાં હાલ ઓધવ વિધા મંદિર કાર્યરત છે.

પરમ પૂજય સંતશ્રી ઓધવરામજી મહારાજશ્રીના સાંનિદયમાં તા.૧૪/૦૪/૧૯૫૪ ના રોજ પ્રથમ સનાતની ત્રિદિવસીય અધિવેશન શ્રી કરમશીભાઈ વીરજીભાઈ ચોપડા અદયક્ષ સ્થાને હીરાપુરકંપા ખાતે કરવામા આવ્યુ હતુ. જેમાં અદયક્ષ શ્રી કરમશીભાઈ ચોપડા દ્વારા રૂ.૧૦૦૧/ નુ માતબર દાન આપવામાં આવ્યુ હતુ. તે સમયે સમાજના પ્રમુખશ્રી હીરજીભાઈ કરસનભાઈ લીંબાણી વિષ્ણુપુરા હતા.અને મંત્રીશ્રી દેવસીભાઈ રામજીભાઈ અણીયોરકંપાવાળા હતા. જે અધિવેશનમા ધનસુરા ખાતે છાત્રાલય બનાવવાનુ નકકી કરવામા આવ્યુ હતુ.જેમા છાત્રાલય માટે ફાળાની રૂ.૬૦૧૭૫/ જેટલી માતબર રકમ એકત્રિત કરવમા આવી હતી.

વર્ષ: ૧૯૫૪ સવંત ૨૦૧૦ ને જેઠ સુદ ૧૨ ના રોજ તખતગઢ હાલ માધવકંપાના દાનવીરશ્રી વાલજીભાઈ ભાણજીભાઈ વાડીયા દ્વારા આ સમાજને રૂ.૨૫૦૦૦/ જેટલુ માતબર દાન આ ધનસુરા સમાજમા ૬ રૂમના દાતાશ્રી તરીકે આપેલ છે જેને આપણે યાદ કરતા સમાજ દ્વારા તેમની પ્રતિમૂર્તિ ની સ્થાપના સમાજ ભવનમા કરેલ છે. આપણા સમાજની ધનસુરા ખાતે તલોદ રોડ પર આવેલ જમીન રૂ.૭૦૦૨/ મા વડીલો દ્વારા રાખવામા આવેલ હતી.જેમા પચાણભાઈ લદધાભાઈ દ્વારા રૂ.૩૧૨૫/ મા રૂમ ૧ અને રૂ.૩૧૨૫/ સ્વ.રવજીભાઈ નારણભાઈ ના ધર્મપત્ની માતાજી માનબાઈના સ્મરણાર્થે બનાવી સમાજને અર્પણ કરેલ છે.સમાજની આ જમીનની ચારે બાજુ કંપાઉન્ડ વોલ અને પાકા કૂવા બનાવવા માટે આજુ બાજુના કંપાઓમાંથી ફાળો કરીને નાંણા એકત્ર કરવામા આવેલ હતા.જેનો કુલ ખર્ચ રૂ.૧૭૧૯૮/ થયેલ હતો.તે સમયે બોરડીટીબાકંપા તરફથી રૂ.૫૦૦/ અને એદલપુરાકંપા તરફથી રૂ.૩૨૫/ જેવી રકમ દરેક કંપાઓ માથી ફાળો એકત્ર કરવામા આવેલ હતો.

આપણી સનાતન સમાજમા વર્ષ:૧૯૭૮ મા થયેલા વિવાદમા આપણી સમાજના વિભિન્ન વિચારધારા વાળા જુથો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. તે સમયે શ્રી શામજીભાઈ સવગણભાઈ વાસાણી વડાગામ, શ્રી અરજણભાઈ વશરામભાઈ ભાવાણી એદલપુરાકંપા, શ્રી બહેચરભાઈ મૂળજીભાઈ ભાવાણી મોતેસરી, શ્રી બાબુભાઈ જશાભાઈ વેલાણી રાજપુરકંપા, શ્રી સવજીભાઈ અરજણભાઈ પોકાર વડાગામ તેમજ તેમની સાથે સમાજના અન્ય વડીલોએ સામાજીક વિવાદમા

realpatidar.com

https://archive.org/details/bk1425/page/n3/mode/1up

અથાગ પ્રયત્નો થકી આપણી સનાતન સમાજનો નામનો બોર્ડ ઉતારવાની વાત હતી ત્યારે આપણા વડીલો દ્વારા લાંબી લડત બાદ આ સનાતન સમાજનો પાયો મજબૂત બનાવ્યો હતો તો આપણે આજના સમયે એ વડીલોને યાદ કરતા વંદન કરીએ છીએ. તા.૧૯/૦૧/૧૯૭૯ ને શુક્રવારના રોજ લવદ પંચનો ઐતિહાસિક લડત મેળવીને સમાજના સભ્યો દ્વારા સુખદ અંત આવેલ હતો. વિવાદ પંચમા મુંબઈથી મણીભાઈ પુંજાભાઈ, માવજીભાઈ પેથાભાઈ, વિશ્રાંમભાઈ હંસરાજભાઈ,પ્રેમજીભાઈ શીવગણભાઈ, શીવદાસભાઈ લાલજીભાઈ, લખમશીભાઈ લદધાભાઈ તેમજ અમદાવાદથી જેઠાભાઈ પુંજાભાઈ અને વડોદરાથી રતનશીભાઈ નારાયણભાઈ તથા જબલપુરથી રામજીભાઈ શામજીભાઈ હાજર રહી સમસ્યાનો સમાજની સનાતની વિચારધારા મુજબ સુખદ અંત આવેલ હતો. તા.૨૩/૦૭/૧૯૭૮ થી સમાજના પ્રમુખ તરીકે શ્રી શામજીભાઈ સવગણભાઈ વાસાણી (મુખી) વડાગામ અને મંત્રી તરીકે તા.૧૮/૦૯/૧૯૭૭ થી શ્રી બહેચરભાઈ મૂળજીભાઈ ભાવાણી, મોતેસરી તેમના અથાગ પ્રયત્નથી આ સમસ્યાનો અંત આવ્યો હતો. મંત્રીશ્રી બહેચરભાઈ મૂળજીભાઈ એ સતત ૨૬ વર્ષ સુધી એટલે કે તા.૦૪/૦૯/૨૦૦૩ સુધી મંત્રી તરીકે સમાજને સેવા આપેલ છે. અને આપણી સનાતન સમાજની દીકરીઓમા શિક્ષણનો વ્યાપ વધે તે માટે શામજીભાઈ સગવણભાઈ વાસાણી અને તેમની ટીમ દ્વારા આપણી સમાજના દરેક વિસ્તારમાંથી કન્યા કેળવણી તીથિ થકી માતબર ભંડોળ દ્વારા શરૂઆતના બે વર્ષ સુધી આપણી સમાજની દીકરીઓને નિઃશુલ્ક ભોજન આપવામા આવતુ હતુ.ત્યાર બાદ આપણી સમાજની દિકરીઓની સંખ્યામા ઉતરોતર વધારો થતા ૫૦ ટકા સુધી ભોજન બીલમા રાહત આપવામા આવતી હતી.મુખી શ્રી શામજીબાપાના ખૂબ પ્રયત્નો થકી આ સમાજે સનાતની સમાજની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યાર બાદ આ સમાજના પ્રમુખ તરીકે શ્રી તુલશીભાઈ વાસાણી,વડાગામ, શ્રી શીવદાસભાઈ માવાણી,માવાણી ફાર્મ, શ્રી બહેચરભાઈ ભાવાણી, મોતેસરી, શ્રી ધનસુખભાઈ રંગાણી,ધનસુરા, શ્રી અમૃતભાઈ રામાણી રાજપુરકંપા,અને મંત્રી તરીકે શ્રી અમૃતભાઈ રામાણી રાજપુરકંપા, શ્રી ભરતભાઈ વેલાણી ધનસુરા, શ્રી રવજીભાઈ રામજીયાણી ફુલપુરાકંપા, એ આ સમાજમા વિશેષ સેવાઓ આપેલ છે. આ સમાજને જાગૃત રાખવા માટે સામાજીક મુખપત્ર જાગૃતિ અંક દ્વારા સમાજને સનાતની વિચારોની ચેતના જગાવી હતી. સમાજની સ્થાપના થઈ ત્યારે પણ સમાજ સનાતની હતો આજે છે અને ભવિષ્યમા રહેશે તેમા કોઈ શંકાને સ્થાન નથી.

સમય જતા આ સમાજ વટવૃક્ષ બની એક વિરાટ સ્વરૂપ ધારણ કરેલ છે. અને તા.૧૬/૦૨/૨૦૧૪ થી વર્તમાન પ્રમુખશ્રી જગદીશભાઈ શામજીભાઈ વાસાણી,વડાગામ અને તેમની સાથે સમાજના હોદ્દેદારો અને સમાજની કારોબારી દ્વારા જર્જરીત થઈ ગયેલ ભવનના સ્થાને નવીન સંકુલ બનાવવાનો વિચાર રજુ કરવામા આવ્યો. જેને સભામા સર્વસંમતિ મંજુરી મળતા નવીન સંકુલ બનાવવા માટે તા.૨૮/૦૧/૨૦૧૭ ને રવિવારના રોજ નવીન સંકુલની વિવિધ ઉછામણી રૂપે દાન એકત્રિત કરવા માટેનો કાર્યક્રમ સનાતની સમાજના પરમ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજ,શ્રી રામજી મંદિર,સુંદરપુરા / મહંત શ્રી મોહનદાસજી મહારાજ,શ્રી ચૈતન્ય સ્વરૂપ આશ્રમ, નખત્રાણા / અને પરમ પૂજય સ્વામી શ્રી શિવાનંદતીર્થજી, વેદાંત આશ્રમ,વલાદ ની વિશેષ ઉપસ્થિતીમા સંતોના આશીર્વાદથી ૨ કરોડ જેટલી માતબર રકમ દાતા શ્રેષ્ઠીઓ દ્વારા પ્રાપ્ત થઈ હતી. જેના થકી નવીન ભવ્ય સંકુલ નિર્માણનો પ્રારંભ કરવામા આવ્યો હતો. સમયજતા આ ટીમ દ્વારા સુગમ અને પારદર્શક વહીવટથી આજે સમાજને દાતા શ્રેષ્ઠીઓ દ્વારા વિશેષ દાન પ્રાપ્ત થતાં આજે અંદાજે ૫ કરોડ જેટલા ખર્ચથી સમાજનુ ભવ્યાતિ ભવ્ય સંકુલનુ નિર્માણ થયેલ છે જે આપ આપની નજર સમક્ષ નિહાળી શકો છો.

realpatidar.com

https://archive.org/details/bk1425/page/n4/mode/1up

·realpatidar.com

શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન નમઃ

ધનસુરા ની આપણી સનાતન સમાજ દ્વારા યુવક સંઘ ની સ્થાપના વર્ષ-૧૯૫૫માં કરવામાં આવેલ હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી વેલજીભાઇ પ્રેમજીભાઈ હડમતીયા લાટ વાળા અને મંત્રીશ્રી તરીકે કેશવલાલ માવજીભાઈ માકાણી હીરાપુર કંપા વાળાએ સેવાઓ આપી હતી. અને તે સમયે સમૂહલગ્નના આયોજન નો ઠરાવ વર્ષ-૧૯૭૪માં કરવામાં આવ્યો અને મહિલા સંઘની સ્થાપના કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો અને સમય અંતરે યુવક સંઘના પ્રમુખ તરીકે શ્રી શામજીભાઈ સવગણભાઇ વાસાણી વડાગામ અને મંત્રી તરીકે અરજણભાઈ વશરામભાઈ ભાવાણી એદલપુરા વાળાએ વર્ષો સુધી સેવાઓ આપી હતી. તે સમયે યુવક સંઘ દ્વારા સનાતની જાગૃતિ લાવવા માટે સનાતની બંધારણો અને ઠરાવો પસાર કરીને આપણી સમાજમાં સનાતની ચેતના જગાવી હતી ત્યારબાદ નિવૃત પ્રિ. રતિભાઈ લધ્ધાભાઈ છાભૈયા બોરડી ટીંબા વાળાએ સેવાઓ આપેલ હતી.

સમય જતાં યુવક સંઘ સુષુપ્ત થઈ ગયેલ. બાદમાં આપણી સમાજના પૂર્વ પ્રમુખશ્રી તુલસીભાઈ શામજીભાઈ વાસાણી વડાગામ વાળાએ વર્ષ-૧૯૯૫માં તેના અધ્યક્ષ સ્થાને યુવક મંડળને જાગૃત કરવામાં આવેલ અને યુવક મંડળના પ્રમુખ તરીકે શ્રી અમૃતભાઈ રામાણી ની વરણી કરવામાં આવી હતી અને સાથોસાથ મહિલા મંડળની પણ સ્થાપના કરવામાં આવી હતી. સમય જતા, સમાજ પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમુહ લગ્નોત્સવ નું આયોજન વર્ષ-૧૯૯૯માં કરવામાં આવેલું હતું. દર વર્ષે વસંત પંચમીના દિવસે સમૂહલગ્નના આયોજન થકી આપણી સનાતન સમાજે દેશભરમાં જ નહિ પરંતુ વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરેલ છે. તે સમૂહ લગ્ન થકી બચત થયેલ ભંડોળ સમાજના વિકાસમાં ખૂબ જ ઉપયોગી નીવડેલ છે.

કોરોના કાળમાં ગત વર્ષે સરકારશ્રી નના માર્ગદર્શન અનુસાર સમૂહ લગ્નનું આયોજન મોકૂફ રાખેલ હતું, પરંતુ ચાલુ વર્ષે હાલના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ધોળુ, મહામંત્રીશ્રી યોગેશભાઈ રામાણી, મંત્રીશ્રી અલ્પેશભાઈ ચોપડા અને સમૂહ લગ્નના કન્વીનરશ્રી જગદીશભાઈ પોકાર અને તેમની યુવક મંડળ ટીમ અને મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી તારાબેન પોકાર અને મંત્રી શ્રીમતી મંગળાબેન ચોપડા અને મહિલા મંડળની ટીમના સહિયારા પ્રયાસથી ચાલુ વર્ષે તારીખ-૦૫/૦૨/૨૦૨૨ને શનિવારના રોજ સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

realpatidar.com

realpatidar.com

આપણી સનાતન સમાજ દ્વારા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાનો વિચાર તારીખ- ૦૭/૦૧/૨૦૦૦ ને શનિવારના રોજ સમાજના પ્રમુખશ્રી શિવદાસભાઈ માવાણી ના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી,યુવક મંડળ અને મહિલા મંડળ સાથેની મિટિંગ મોતેસરી કંપા મુકામે મળેલ હતી. જેમાં બાલમંદિર થી ધોરણ- ૪ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની કાર્યવાહી કરવા માટે શ્રી પરષોત્તમભાઇ મેઘજીભાઈ ભાવાણી મોતેસરી વાળાને કામગીરી સોંપવામાં આવી હતી અને શાળાની શરૂઆત તારીખ-૦૧/૦૬/૨૦૦૧ થી કરવામાં આવી હતી. જેનું નામ પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામજી મહારાજના પ્રેરણાથી શ્રી ઓધવ વિદ્યા મંદિર, ધનસુરા એવું નક્કી કરવામાં આવેલ હતું. શાળાના સુચારૂ સંચાલન માટે શાળાના પ્રમુખ તરીકે પ્રિન્સીપાલ શ્રી આર. એલ. પટેલ સાહેબે ઉત્તમ સેવાઓ આપેલ હતી. શરૂઆતમાં જૂજ બાળકો થી શરૂ થયેલ શાળા સમય જતાં બાળકોની સંખ્યામાં વધારો થતાં સમાજની રૂમોમાં સમાવેશ ન થવાના કારણે છાત્રાલય સંકુલમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ સમાજ ભવનનું બાંધકામ જૂનું અને જર્જરિત હોવાના કારણે નવીન સમાજ ભવન અને નવીન શૈક્ષણિક સંકુલ બનાવવાનો વિચાર હાલના પ્રમુખ શ્રી જગદીશભાઈ વાસાણી વડાગામ અને તેમની ટીમની સાથે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ સુરાણી અને સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ભાવાણી દ્વારા કરવામાં આવેલ હતો. હાલ આપની વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય સંતોની હાજરીમાં નવીન સંકુલનું ભૂમિ પૂજન અને ખાતમૂહર્ત કરવામાં આવેલ હતું તે સમયે અપૂરતું ભંડોળ હતું, પરંતુ સંતોના ચરણ રજ જે ભૂમિ પર હોય તેના ઉપર આ ટીમે પૂરતા વિશ્વાસ સાથે નવીન સંકુલનું નિર્માણ શરૂ કર્યું હતું. સમય જતાં જેમ જેમ સંકુલનું નિર્માણ ચાલુ હતું તેમ તેમ દાતાશ્રીઓ દ્વારા અવિરત દાનનો સ્ત્રોત ચાલુ રહેતા નવીન સંકુલનું ભવ્યાતિભવ્ય નિર્માણ પૂર્ણ થઈ ગયેલ છે. જે આજે ધનસુરા તાલુકાનું અને આપણા સમાજ માટે ગૌરવ છે જે આપ નિહાળી રહ્યા છો.

અને છેલ્લે

આ સમગ્ર ટીમની હુફ અને માર્ગદર્શનથી આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ અંતે હું એટલું જ કહીશ કે

"વાદ- ના વિવાદ ફક્ત અને ફક્ત સમાજનો જ વિકાસ"

જય સનાતન જય લક્ષ્મીનારાયણ

realpatidar.com